



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૮/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૪૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૦ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી, ૨૧૧ લીટર દેશી દારૂ, ૮૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૮૩ ક્વોર્ટર ઇંગ્લીશ દારૂ અને ૧૨ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૦૮ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૬૦,૧૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૪૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૪૩/૧૯

**કાલુપુર :** જહેરાબહેન વા/ઓ કમ્મરઅલી બટ્ટી (ઉ.વ.૫૨)(રહે.ગામ-બાદરપુર, તા-વડનગર, જિલ્લો-મહેસાણા) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૮/૨૦૧૯ બપોરના ૩/૦૦ થી ૩/૩૦ વાગ્યા દરમિયાન કાલુપુર રતનપોળ, ગોલવાડ ની સામે આવેલ “પટરાણી” નામની દુકાનમાં આવેલ એક અજાણી સ્ત્રી (૫૦ થી ૬૦ વર્ષના આશરાની) એ જહેરાબહેનની નજર ચુકવી તેમના ખભે ભરાવેલ પર્સમાંથી રોકડ રૂપિયા ૩૭,૦૦૦/- મુકેલ પાકીટની ચોરી કરી નાસી ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.ચોધરી ચલાવે છે.

કરંટ લાગતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૪૪૪/૧૯

**નારોલ :** અનીલ પિતામ્બર યાદવ (ઉ.વ.૩૩)(રહે.સૈજપુર ગોપાલપુર શીતલ ડાયકેમ કોર્પોરેશન કંપનીની પાછળ પીપળજ નારોલ) તા.૨૬/૦૮/૧૯ ના કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે “શીતલ ડાયકેમ કોર્પોરેશન” નામની કંપનીમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક કરંટ લાગતા, નીચે પડી જતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરના ૧/૧૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી શંકરભાઈ હીરજીભાઈ ચલાવે છે.

**રીવરફ્રન્ટ ઇસ્ટ :** રાહુલભાઈ મનુભાઈ પરમાર (ઉ.વ.૨૮)(રહે.અયોદય જીનીંગ મીલની નવી ચાલી બબુપુરા અસારવા) એ તા.૨૬/૦૮/૨૦૧૯ ના કલાક ૧૧/૩૫ વાગ્યા પહેલા કોઈપણ સમયે સુભાષબ્રીજ નીચે નારણઘાટ ખાતે સાબરમતી નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી છે. આ અંગે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નિશારઅહેમદ ઉસ્માનમિયા ચલાવે છે.

**સેટેલાઈટ :** મયુરભાઈ રાજુભાઈ પરમાર (ઉ.વ.૨૫)(રહે.રણુજાનગર વિભાગ-૨ ચાલી નં-૨ જોગણી માતાના મંદિર પાસે સેટેલાઈટ) એ તા.૨૬/૦૮/૨૦૧૯ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે રણુજાનગર ખાતેના ભાડાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે સેટેલાઈટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જી.લીંબોલા ચલાવે છે.

**ઓઢવ :** ભરતભાઈ રમેશભાઈ મોદી (ઉ.વ.૪૨)(રહે.ચંદ્ર સોસાયટી રાજેન્દ્રપાર્ક ચાર રસ્તાની બાજુમાં ઓઢવ) એ તા.૨૬/૦૮/૨૦૧૯ ના કલાક ૨/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરના રસોડામાં નાયલોન ની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતીલાલ જીવાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.